

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર ક્લાર્ક(વહીવટ/હિસાબ)

ADVISORY FOR CANDIDATES

૧. જુનીયર ક્લાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૨૯-૦૧-૨૦૨૩ ના રોજ નિયત કરાયેલ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. ઉપરોક્ત પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા ખુબ જ વિશેષ પ્રમાણમાં હોઇ, પરીક્ષાના દિવસે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવામાં તકલીફ ન થાય તે ધ્યાનમાં રાખી દરેક ઉમેદવારને તેનું પરીક્ષા કેન્દ્ર જે શહેરમાં આવેલું હોય તે શહેરમાં પરીક્ષાના આગળના દિવસે પહોંચી જાય તેવી સલાહ દરેક ઉમેદવારને આપવામાં આવે છે. જેથી પરીક્ષાના દિવસે તેઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ રહે નહિ.

૨. ઉમેદવાર પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી, તેને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાના દિવસે સમયસર પહોંચી જાય તે રીતે પોતાનું આયોજન કરી લેવા પણ સલાહ આપવામાં આવે છે.

૩. પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવાર માત્ર પોતાનું પ્રવેશપત્ર(કોલલેટર/હોલટીકીટ), પેન અને ઓળખના પુરાવા માટેનું અસલ ફોટો ઓળખપત્ર (આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ વિગેરે પૈકી કોઇ એક) લઇને પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ કરી શકશે. કોઇ પણ ઉમેદવાર મોબાઇલ, સ્માર્ટવોચ, બ્લુટૂથ, કેમેરા, ઇયરફોન, લેપટોપ વિગેરે ઇલેક્ટ્રોનિક ગેઝેટ કે પુસ્તક, અન્ય કોઇ પણ સાહિત્ય, બેગ વિગેરે પ્રકારની કોઇ પણ વસ્તુ લઇને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી શકશે નહિ, જેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી. પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ આપતા પહેલા પોલીસ ધ્વારા ફ્રિસ્કીંગ (Frisking) કરવામાં આવનાર હોઇ, જેથી પરીક્ષા કેન્દ્ર ખાતે આવી વસ્તુઓ સાથે “ના” લાવવા દરેક ઉમેદવારને જણાવવામાં આવે છે.

૪. દરેક ઉમેદવારને તેના પ્રવેશપત્ર(કોલલેટર/હોલટીકીટ) સાથે આપવામાં આવેલ સુચનાઓનો અભ્યાસ કરી, તેનું ચુસ્તપણે પાલન કરવા દરેક ઉમેદવારને જણાવવામાં આવે છે.

તારીખ:- ૨૪-૦૧-૨૦૨૩

સચિવ